

લોડેડ દેશી તમંચા સાથે પરપ્રાન્તીય યુવાનને ઝડપી પાડતી, કાઈમ બ્રાંચ

આગામી સ્વતંત્ર દિવસ અન્વયે સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર તેમજ શહેર વિસ્તારમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા સારૂ કાઈમ બ્રાંચના અધિકારી/પોલીસ માણસો જુદી જુદી ટીમો બનાવી સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હે.કો. હરપાલસિંહ જશુભા તથા હે.કો.હરીસિંહ વિરસંગભાઈ નાઓને મળેલ બાતમી આધારે પો.સ.ઈ.શ્રી.સી.એચ.પનારા સહિતની ટીમે અમરોલી શ્રીરામ ચોક પાસેથી આરોપી શિવમ ઉર્ફે બાબા S/O ઉમાશંકર પાંડે ઉ.વ.૨૧ રહે-અમરોલી આવાસ બિલ્ડીંગ નંબર-૩૭૭ રૂમ નંબર-બી/૧૭, સુરત મુળ રહે-ગામ-મહોલી,થાના-કોરાવ જી-અલ્હાબાદ ઉત્તરપ્રદેશ નાઓને એક લોડેડ દેશી તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મજકુર આરોપીની પુછપરછમાં તેનો એક મિત્ર અજય ઉર્ફે રાહુલ ઉર્ફે જટા નામનો ઈસમ જે અગાઉ કોસાડ આવાસમાં રહેતો તેનો એક હનિસીંગ રાજપુત નામના ઈસમ સાથે કોઈક કારણસર ઝઘડો તથા તેના માથામાં તલવારનો ઘા મારી આ અજય ઉર્ફે રાહુલ ઉરે જટાએ ગંભીર ઈજા પહોચાડતા મજકુર અજય ઉર્ફે રાહુલ ઉર્ફે જટા વિરુદ્ધ અમરોલી પો.સ્ટે. 1 ગુ.ર.નં.૧૬/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૦૭,૩૨૩,૩૨૪,૧૧૪, મુજબનો ગુનો દાખલ થતા આ અજય ઉર્ફે બાબા પાંડે પાસે આવી આ તમંચો વેચાતો રાખી લેવાની વાત કરતા હાલના આરોપીએ ના પાડતા હમણા આ તમંચો અને કાર્ટીઝ રૂ.૩૦૦૦/- માં ગીરવી રાખી મને પૈસા આપ હું થોડા સમયમાં સુરત આવી રૂપીયા પરત આપી તમંચો લઈ જઈશ તેમ વાત કરતા હાલના આરોપીઓએ પોતાની પાસે તમંચો રાખી લીધેલ હતો અને તેનો મિત્ર અજય ઉર્ફે રાહુલ ઉર્ફે જટા આજદિન સુધી પરત આવેલ ન હોય અને હાલમાં પકડાયેલ આરોપીની પૈસાની જરૂર પડતા તે આ તમંચો વેચાણ કરવા નીકળેલો આ વખતે મળેલ બાતમી આધારે તેને ઝડપી પાડેલ છે.

હાલનો પકડાયેલ આરોપી અમરોલી પો.સ્ટે. 1 ગુ.ર.નં. ૧૦૪/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૦૭, ૩૩૭, ૩૩૩, ૧૮૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪ તથા જી.પી.એક્ટ કલમ તેમજ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ ૨૦૧૬ ની કલમ ૧૨૦(૨) મુજબના તેમજ પ્રોહીબેશન ગુનાઓમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.